


MANTRAS OF THE MOTHER / શ્રી માતાજીના મંત્રો

1 June 1954 / ૧ જૂન ૧૯૫૪

Do not think of what you have been, think only of what you want to be and you are sure to progress.


With my blessings



2 June 1954 / ૨ જૂન ૧૯૫૪

Do not look behind, look always in front, at what you want to do - and you are sure of progressing

with my blessings



8 June 1954 / ૮ જૂન ૧૯૫૪

If earnestly you say to the Divine, "I want only Thee", the Divine will arrange the circumstances in such a way that you are compelled to be sincere.


with my blessings



4 July 1954 / ૪ જુલાઈ ૧૯૫૪

No joy is comparable to the feeling of the eternal Presence in one's heart.

With my blessings



Do not think of what you have been, think only of what you want to be and you are sure to progress. **With my blessings**

તમે જે હતા એનો વિચાર ન કરો, તમારે જે થવું છે એનો વિચાર કરો, અને તમે જરૂર પ્રગતિ કરશો.

મારા આશીર્વાદ સાથે

Do not look behind, look always in front, at what you want to do - and you are sure of progressing. **With my blessings**

પાછળ ન જુઓ, હમેશાં સામે જ નજર રાખો, તમારે જે કરવું છે એની તરફ- અને તમે જરૂર પ્રગતિ કરવાના.

મારા આશીર્વાદ સાથે

If earnestly you say to the Divine, "I want only Thee", the Divine will arrange the circumstances in such a way that you are compelled to be sincere. **With my blessings**


તમે જો ખરા દિલથી પ્રભુને કહો "મારે તું જ જોઈએ" તો પ્રભુ બધા સંજોગો એવી રીતે ગોઠવશે કે તમારે સત્યનિષ્ઠ બનવું જ પડે.

મારા આશીર્વાદ સાથે

No joy is comparable to the feeling of the eternal Presence in one's heart. **With my blessings**

પોતાના હૃદયમાં રહેલા અનંત પ્રભુની હાજરીના અનુભવની સાથે અન્ય કોઈ આનંદની સરખામણી થઈ ન શકે.

મારા આશીર્વાદ સાથે



Prosperity

2019

APRIL

૧ એપ્રિલ, ૨૦૧૯

શ્રી માતાજીની

સિદ્ધિ-રિદ્ધિ

Only Thy Servant

કેવળ તારી સેવક

Humbly, quietly, my prayer rises to Thee, O sweet Master, Thou who acceptest without argument and without censure all that is offered to Thee, Thou who givest Thyself and makest Thyself known to all, without asking whether they are worthy of it or not, Thou who findest nothing too weak, too small, too modest, too inadequate to manifest Thee. . . .

Let me lay myself at Thy feet, let me melt into Thy heart and disappear in Thee, let me be annihilated in Thy beatitude, or rather let me be only Thy servant, claiming nothing more. I desire, I aspire for nothing else. To be only Thy servant is all I ask.

— The Mother

July 27, 1914

Prayers & Meditations

એક મૃદુલ ભાવે, વિનમ્ર ભાવે મારી પ્રાર્થના તારા પ્રતિ ઉપર ચડી રહી છે, હે મધુર ગુરુ! તું કે જે, વિના દલીલ-વિના ટીકા, તને જે કંઈ અર્પણ કરવામાં આવે છે તે સ્વીકારી લે છે; તું કે જે તારી પોતાની જાત બધાંને આપે છે અને તારી ઓળખાણ થવા દે છે, વિના પૂછે કે તેઓ તારે પાત્ર છે કે નહિ; તું કે જેને તારા આવિર્ભાવ માટે કશું જ બહુ નબળું, બહુ નાનું, બહુ વિનમ્ર અને બહુ ઊણપવાળું લાગતું નથી. . . .

તારાં ચરણોમાં મને સૂવા દે, તારા હૃદયમાં ઓગળી જઈ તારામાં એક બની જવા દે. એ કરતાંય, મને માત્ર તારી સેવક બનવા દે, બીજી કોઈ ઇચ્છા નથી, બીજી કોઈ અભીપ્સા નથી. કેવળ તારી સેવક બની રહું એટલું જ હું માગું છું.

— શ્રી માતાજી

From: Dakshina Karyalaya, Sri Aurobindo Ashram, Pondicherry-2. © 0413-2331470

રવાના: દક્ષિણા કાર્યાલય, શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી-૨ © ૦૪૧૩-૨૩૩૧૪૭૦ • April 2019

<https://themothersprosperity.org>

૨૭ જુલાઈ, ૧૯૧૪

પ્રાર્થનાઓ અને ધ્યાન

**A prayer for those who wish
to serve the Divine**

Glory to Thee, O Lord, who triumphest over every obstacle.

Grant that nothing in us shall be an obstacle in Thy work.

Grant that nothing may retard Thy manifestation.

Grant that Thy will may be done in all things and at every moment.

We stand here before Thee that Thy will may be fulfilled in us, in every element, in every activity of our being, from our supreme heights to the smallest cells of the body.

Grant that we may be faithful to Thee utterly and for ever.

We would be completely under Thy influence to the exclusion of every other.

Grant that we may never forget to own towards Thee a deep, an intense gratitude.

Grant that we may never squander any of the marvellous things that are Thy gifts to us at every instant.

Grant that everything in us may collaborate in Thy work and all be ready for Thy realisation.

Glory to Thee, O Lord, Supreme Master of all realisation.

Give us a faith active and ardent, absolute and unshakable in Thy Victory.

October 23, 1937*
Prayers & Meditations

– The Mother

**પ્રભુની સેવામાં રહેવા ઇચ્છનાર માટે
એક પ્રાર્થના**

હે વિઘ્નમાત્રના વિજેતા, તારો જય હો, પ્રભુ!

અમારી અંદર કશું પણ તારા કાર્યમાં વિઘ્નરૂપ ન બનો.

તારા આવિર્ભાવમાં કશું પણ વિલંબરૂપ ન બનો.

સર્વ પદાર્થોમાં પ્રત્યેક પળે તારી ઇચ્છા પૂર્ણ બનો.

તારી સમક્ષ અમે આવ્યાં છીએ એટલા માટે કે તારી ઇચ્છા

અમારામાં સિદ્ધ થાય, અમારા એકેએક તત્ત્વમાં, અમારી એકેએક પ્રવૃત્તિમાં, અમારી ચેતનાનાં ઉચ્ચોચ શિખરોથી માંડી અમારા શરીરના નાનામાં નાના અણુ સુધી.

અમારી નિષ્ઠા કેવળ તારામાં જ રહો, સંપૂર્ણ અને સદાયને માટે.

અમારે કેવળ તારા પ્રભાવમાં રહેવું છે, અન્ય કોઈના નહિ.

અમે તારા પ્રત્યે હૃદયના ઊંડાણમાંથી તીવ્ર ભાવે કૃતજ્ઞ રહેવાનું ભૂલીએ નહિ.

તું હરપળે અમને અદ્ભુત વસ્તુઓ તારી પ્રસાદીરૂપે આપી રહ્યો છે. એનો અમે કદી દુર્વ્યય ન કરીએ.

અમારામાંની પ્રત્યેક વસ્તુ તારા કાર્યમાં સહકાર આપો. તારા સાક્ષાત્કાર માટે સર્વ કંઈ તૈયાર થાઓ.

સર્વ સાક્ષાત્કારોના હે પરમ ગુરો, તારો જય હો, પ્રભુ !

તારા વિજયમાં અમને શ્રદ્ધા આપ, જીવંત અને જ્વલંત, અનન્ય અને અચલ.

– શ્રી માતાજી

૨૩ ઓક્ટોબર ૧૯૩૭*
પ્રાર્થનાઓ અને ધ્યાન